



ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન અને રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન,
ગાંધીનગર

ઈન્દોડા નેચર પાર્ક, પો.ઓ. સેક્ટર-૭, ગાંધીનગર-૩૮૨ ૦૦૭, ગુજરાત

કામગીરીનું નામ: માંડવી અને ડુમ્મસ(સુરત) ખાતેના ફિલ્ડ સ્ટેશનો ખાતે ફિલ્ડસ્ટેશન આસીસ્ટન્ટની
કરાર આધારીત ધોરણે હંગામી જગ્યા ભરવા અંગે

“ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરની કચેરી હેતુ આઈસીઝેડએમ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલ ઉક્ત બંને ફિલ્ડ સ્ટેશનો ખાતે ફિલ્ડ સ્ટેશન આસીસ્ટન્ટ ની ૧૧ માસના કરાર આધારીત માસિક પગાર રૂ.૬,૫૦૦/- થી નિયુક્તિ કરવાની થતી હોઈ, જે હેતુ ધોરણ-૧૦ પાસ હોય તેવા તા.૧૫/૦૧/૨૦૧૭ સુધીમાં વય મર્યાદા ૪૫ વર્ષથી વધુ ન હોય તેવા ઉમેદવારો માટે ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે તા.૧૬/૦૧/૨૦૧૭ ના રોજ ‘વોક-ઈન ઈન્ટરવ્યુ’ સવારે ૧૧ કલાકે ગોઠવવામાં આવેલ છે, જેમાં ભાગલેવા ઈચ્છુક જે તે ઉમેદવારે સ્વખર્ચે કચેરી ખાતે લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો તથા દરેકની નકલના એક સેટ, ફોટોગ્રાફ વગેરે સાથે સમયસર હાજર રહેવું. લગત ભરતી અન્વયેની નિર્ધારિત ક્યોનુસારની જોગવાઈઓ, શરતો અને કામગીરીની વધુ વિગત અત્રેની વેબસાઈટ: www.geerfoundation.gujarat.gov.in પરથી મેળવી શકાશે તથા વધુ માહિતી અત્રેની કચેરી ખાતે ફોન:૦૭૯-૨૩૯૭૭૩૧૧/૩૨૫/૩૪૧ પરથી મેળવી શકાશે.

— નાયબ નિયામક (આર એન્ડ ડી)

(જાહેરાતનો નમુનો)

‘વોક-ઇન-ઇન્ટરવ્યુ’ તા.૧૬/૦૧/૨૦૧૭, સમય : સવારે ૧૧ કલાકે(ઉમેદવારોએ સવારે ૧૦.૩૦કલાકે હાજર રહેવું), ઇન્ટરવ્યુ સ્થળ:

‘ગીર’ ફાઉન્ડેશન, ઇન્દોડા પ્રકૃતિ ઉદ્યાન, ‘ચ-૦’ સર્કલ પાસે, જ રોડ, ગાંધીનગર- ૩૮૨ ૦૦૭

માંડવી(કચ્છ) અને ડુમ્મસ(સુરત) ખાતે ફીલ્ડ સ્ટેશન આસીસ્ટન્ટની તદ્દન હંગામી રીતે કરાર આધારિત ધોરણે જગ્યા ભરવા સબબ કચેરીના પત્રાંક : ગીર/આઇસીએમપી/બ-૮૩૫૪-૫૫, તા.૦૩/૦૧/૨૦૧૭ થી લગત જાહેરાત અખબારમાં પ્રકાશિત કરવા હેતુ

મોકલવામાં આવેલ પત્ર

જોબ પ્રોફાઇલ- ફીલ્ડ સ્ટેશન આસીસ્ટન્ટ, ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર

લાયકાત: ધોરણ- ૧૦ પાસ

વય મર્યાદા: તા. ૧૫/૦૧/૨૦૧૭ સુધીમાં ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

કામગીરીની વિગત:

- ૧) સદરહું જગ્યા ખાસ કરીને સલામતી, સૂરક્ષા, દેખરેખને લગતી હોઇ પૂરૂષ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
 - ૨) જે તે ફીલ્ડ સ્ટેશન ખાતેના ગ્રુપ લીડરની સુચનાનુસાર-વ-અત્રેની કચેરીના ધારા ધોરણ મુજબની કામગીરીઓ કરવાની રહેશે.
 - ૩) જે તે ફીલ્ડ સ્ટેશનની દેખરેખ, સાર સંભાળ-વ-ફીલ્ડ સ્ટેશન મકાન કે માલ મિલકતને કોઇ નુકશાન ન પહોંચાડે તે લગત સલામતીની કામગીરીઓ કરવાની રહેશે.
 - ૪) જે તે ફીલ્ડ સ્ટેશન ખાતે લેબોરેટરી સર સાધનો, ઉપકરણો, સામગ્રીની ગ્રુપ લીડરની સુચનાનુસાર દેખરેખ સાર સંભાળ, ચોખ્ખાઇ, જાળવણી-વ- ગોઠવણની કામગીરીઓ કરવાની રહેશે.
 - ૫) જે તે ફીલ્ડ સ્ટેશન ખાતેના ગ્રુપ લીડરની સુચનાનુસાર તૈયાર કરવામાં આવતા દસ્તાવેજો, રીપોર્ટ, પત્રો વગેરેની ગોઠવણની કામગીરીમાં મદદ કરવાની રહેશે.
 - ૬) જે તે ફીલ્ડ સ્ટેશન ખાતે સંશોધન કાર્ય હેતુ ઉપગોગમાં લેવામાં આવતા અલગ અલગ નમુનાઓ-વ-અન્ય લગત સામગ્રીની ગ્રુપ લીડરની સુચનાનુસાર દેખરેખ સાર સંભાળ, ચોખ્ખાઇ, જાળવણી-વ-ગોઠવણની કામગીરી કરવાની રહેશે.
 - ૭) જે તે ફીલ્ડ સ્ટેશન ખાતેના ગ્રુપ લીડર ઉપરાંત અત્રેની કચેરીના સિનિયર સ્ટાફ-વ-અધિકારીશ્રીઓ દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓની અમલવારી કરવાની રહેશે.
 - ૮) જે તે ગ્રુપ લીડરની સુચનાનુસાર જરૂર પડવે ફીલ્ડ સ્ટેશન ખાતે સાથે રહી તેઓને મદદની કામગીરી કરવાની રહેશે.
 - ૯) પ્રોજેક્ટ સમય પૂરતાની આધિન કરાર આધારિત જગ્યા હોઇ, કોઇ કાયમી હકક લાગૂ પડતો નથી. અત: દરેક વર્ષે સમીક્ષા થયેથી પૂન: રાખી શકાશે અથવા છૂટા પણ કરવામાં આવશે.
 - ૧૦) જે તેની પસંદગી થયેથી જાણ કર્યેથી જે તે ફીલ્ડ સ્ટેશન/મૂખ્ય મથકે દિન-૧૦માં અથવા જે તે લગત નિમણુંક પત્રમાં જણાવેલ સમય મર્યાદામાં ફરજિયાત હાજર થવાનું રહેશે અન્યથા નિમણુંક રદ ગણાશે.
 - ૧૧) જે તેની પસંદગી થયેથી કચેરી ખાતેના ઉપરી અધિકારીશ્રીઓ કે તેઓના નિયંત્રણ અધિકારીશ્રી તથા જે તે ફીલ્ડ સ્ટેશન ખાતેના ગ્રુપ લીડરની સુચનાઓનુસાર સોંપવામાં આવતી કામગીરીઓ શિસ્તબધ્ધ રીતે અને જવાબદારી પૂર્વક નિભાવવાની રહેશે તથા જે તેને તેઓના નિમણુંક પત્રમાં દર્શાવેલ શરતો, સૂચના મુજબ લગત કામગીરી કરવાની રહેશે.
 - ૧૨) જે તેની પસંદગી થયેથી જે તે ફીલ્ડ સ્ટેશન/મૂખ્ય મથકે ફરજ દરમ્યાન દાખવેલ નિષ્કાળજી કે બેદરકારીના કિસ્સામાં વધુમાં વધુ બે વખત લેખિતમાં તાકીદ કરવામાં આવશે. પરંતુ ગંભીર પ્રકારની નિષ્કાળજી, બેદરકારી કે ગુનાહીત પ્રવૃત્તિના કિસ્સામાં તાત્કાલીક રૂએ છૂટા કરવામાં આવશે અને નિયમાનુસાર પગલા ભરવામાં આવશે.
- પગાર : અત્રેની કચેરી દ્વારા નક્કી કરવામાં આવતાં ધારા ધોરણો મુજબ રૂ. ૬,૫૦૦/- પ્રતિમાસ (આ વેતન સિવાય અન્ય કોઇ પણ પ્રકારનાં ભથ્થાં કે વળતર મળવાપાત્ર થશે નહીં. સિવાય કે ગ્રુપ લીડર/કચેરીની સૂચના મુજબ જો કોઇ પ્રવાસ કરેલ હશે તો તે અન્વયે કચેરી નિયમાનુસાર TA/DA મળવા પાત્ર થશે).

નોંધ: લગત તારીખના રોજ ગોઠવવામાં આવેલ ‘વોક-ઇન-ઇન્ટરવ્યુ’ માં અત્રેની કચેરી ખાતે અરજી પત્રક તથા સંલગ્ન ડોક્યુમેન્ટસ સહીત હાજર રહેનાર જે તે ફીલ્ડ સ્ટેશન વિસ્તાર-ક્ષેત્રના ઉમેદવારો જોગ- ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગરની કચેરી ખાતે ગોઠવવામાં આવેલ લગત ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે આવવાનું રહેશે (ટ્રાવેલીંગ કે અન્ય કોઇ ખર્ચ કચેરી દ્વારા ચૂકવવામાં નહીં આવે).